



**HDV-001-034102**      Seat No. \_\_\_\_\_

**M. A. (Geo.) (Sem. I) (CBCS) Examination**

**November / December – 2017**

**Climatology - 02 - C-4051**

**Faculty Code : 001**

**Subject Code : 034102**

Time :  $2\frac{1}{2}$  Hours]

[Total Marks : 70]

- સૂચના :** (૧) દરેક પ્રેશન ફરજિયાત છે.  
(૨) જરૂર હોય ત્યાં સ્વચ્છ આકૃતિ / નકશા દોરો.

**૧** આબોહવાશાસ્ત્રનો અર્થ, વિકાસ અને વિખ્યવસ્તુ સમજાવો.      ૧૪

**અથવા**

**૧** પૃથ્વીનું વાતાવરણ જે પ્રક્રિયાથી ગરમીનું વ્યવસ્થિત સંતુલન જાળવે છે તેની ચર્ચા કરો.      ૧૪

**૨** સૂર્યઘાતની વ્યાખ્યા આપી સૂર્યઘાતના વિતરણ પર અસર કરતાં પરિબળોની ચર્ચા કરો.      ૧૪

**અથવા**

**૨** તાપમાન એટલે શું ? તાપમાનના વિતરણ પર અસર કરતાં પરિબળોની ચર્ચા કરો.      ૧૪

**૩** વાતાવરણનું દબાણ એટલે શું ? દબાણનું ઉધ્વ વિતરણ અને ક્ષિતિજ સમાંતર વિતરણ જણાવો.      ૧૪

**અથવા**

**૩** ઘનીભવન એટલે શું ? ઘનીભવનનાં વિવિધ સ્વરૂપોની સમજૂતી આપો.      ૧૪

**૪** વાયુસમુચ્યયના મુખ્ય પ્રકારોની ચર્ચા કરો.      ૧૪

**અથવા**

**૪** વાતાગ્ર એટલે શું ? વાતાગ્રના પ્રકારો જણાવો.      ૧૪

**૫** ટૂંકનોંધ લખો : (ગમે તે બે)

- (૧) મોસમી પવનોની રચના
- (૨) ઉઝ્જાકટિબંધીય ચકવાત
- (૩) સ્થાનીય પવનો
- (૪) પ્રતિચકવાત.

## **ENGLISH VERSION**

**Instructions :** (1) All questions are compulsory.  
(2) Draw neat diagram/map wherever necessary.

**1** Explain meaning, scope and subject matter of climatology. **14**

**OR**

**1** Discuss the processes through which the earth atmosphere **14** system maintains heat balance .

**2** What is Insolation ? What are the factors affecting the **14** distribution of Insolation.

**OR**

**2** What is Temperature ? What are the factors affecting **14** the distribution of Temperature ?

**3** What is atmospheric pressure ? What are the factors **14** affecting the horizontal and vertical distribution of Pressure ?

**OR**

**3** What is condensation ? Give a detail information about **14** different types of condensations.

**4** Discuss the major types of air masses. **14**

**OR**

**4** What is front ? Give the types of fronts. **14**

**5** Write short notes : (any **two**) **14**

- (1) Mechanism of monsoon
- (2) Tropical cyclone
- (3) Local Winds
- (4) Anticyclone.